



પાર્કિંગ, પાર્ક્સ અને રમતગમતના મેદાનો: સિટી તેના નાગરિકોને COVID-19 દરમિયાનનાં બાય-લોઝની સ્મૃતિ કરાવે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (14 મે 2020) – સિટી ઓફ બ્રમ્પટન પોતાના રહેવાસીઓને COVID-19 મહામારી અને આખા વર્ષ દરમિયાન અમલમાં રહેલ બાય-લોઝનું પાલન કરવાની અગત્યતાની સ્મૃતિ કરાવે છે. બાય-લોઝ એટલા માટે છે કે સિટીની સુરક્ષા અને સફાઈ જળવી શકાય અને દરેક બ્રમ્પટનવાસીની આ ધોરણો જળવી રાખવામાં અગત્યની ભૂમિકા છે.

જે વ્યક્તિઓ નિયમનો ભંગ કરે તેઓને [બ્રમ્પટન COVID-19 ઈમર્જન્સી મેજર્સ બાય-લો](#) હેઠળ પ્રત્યેક ગુના માટે ઓછામાં ઓછા \$500 અને મહત્તમ \$1,00,000 ફાઈન કરવાની જોગવાઈ છે અથવા તો તેઓએ ઈમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ (EMCPA) હેઠળ દંડ ભોગવવો પડશે. જો તેઓ તેનું પાલન ન કરે તો તેમને સિટીનાં અન્ય સુસંગત બાય-લોઝ હેઠળ પણ દંડિત કરવામાં આવી શકાય.

વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરવા બાબત

સિટીનો [ટ્રાફિક બાય-લો 93-93](#) જોગવાઈ કરે છે કે કોઈપણ વાહન ક્રુટપાથના કોઈપણ ભાગમાં એવી રીતે પાર્ક કરશે નહીં જ્યાં અવરોધ ઉત્પન્ન થાય. આમ કરવાથી ક્રુટપાથનો ઉપયોગ કરનારાઓ માટે ભયજનક પુરવાર થઈ શકે અને આંટો મારતા લોકો, વ્હીલચેર્સ અને પગપાળા જતા લોકો માટે અવરોધ સર્જે છે. બાય-લો હેઠળ વાહનો પણ એવી રીતે પાર્ક કરવા ન જોઈએ જ્યાં ટ્રાફિક માટે અવરોધ ઉત્પન્ન થાય. કોઈપણ પાર્ક કરેલ વાહનનો ભાગ હાઈવે પર હોવો જોઈએ નહીં.

જરૂર પડે તો રહેવાસીઓ બૂલવર્ડના પેવ કરેલ હિસ્સામાં કર્બની સમાંતર પાર્ક કરવાનું વિચારી શકે છે. આવી રીતે પાર્ક કરવામાં આવે ત્યારે પણ વાહનો દ્વારા માર્ગ પર અથવા ક્રુટપાથ પર દબાણ કરવું જોઈએ નહીં.

આવા સમયે, આગળની સૂચના સુધી તમામ શહેરની માલિકીની પાર્કિંગની જગ્યા જાહેર જનતા માટે બંધ હોવાથી સિટી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઈમર્જન્સી સેવાઓ સંબંધિત બાબતો જેમ કે: અવરોધિત ડ્રાઈવ વે અને ફાયર હાયડ્રન્ટ્સ, અવરોધિત ક્રુટપાથ, રસ્તાના અવરોધો, અગ્નિશમનનાં માર્ગો જેવા અપવાદો સાથે ઓન-સ્ટ્રીટ પાર્કિંગના અમલને અસ્થાયી ધોરણે સ્થગિત કરી દીધા છે જ્યાં સુનિશ્ચિત થાય કે ઈમર્જન્સી વાહનો મુક્તપણે પસાર થઈ શકે.

પાર્ક્સ અને ટ્રેઈલ્સનો ઉપયોગ

સિટી પાર્ક્સ બંધ છે ત્યારે થી પગથીઓ પરથી અને ટ્રેઈલ્સ પરથી જવાની છૂટ છે. આઉટડોર રિક્રિએશનલ ફેસિલિટીઝનાં ઉપયોગ પર હળું પણ પ્રતિબંધ છે:

- રમતના મેદાન અને પાર્કમાં રહેલ અન્ય બાંધકામો;
- પિકનિકના સ્થળો, બાંકડા અથવા શેલ્ટરો
- આઉટડોર સ્પોર્ટ્સ સવલતો અને આઉટડોર ફિટનેસ સાધનો જેમાં સામેલ છે બાસ્કેટ બોલ અને ટેનિસ કોર્ટ્સ;



- રિક્રિએશન સેન્ટરો અને તેની આસપાસની જમીન; અને
- પાર્કિંગ લોટ્સ

રહેવાસીઓને તે પણ સ્મૃતિ કરાવવામાં આવે છે કે શ્વાનોને કોઈપણ સિટીના પાર્કમાં લીશ એટલેકે બંધન વિના રખડવા દેવા નહીં અને બંધન મુક્ત શ્વાન ઉઘાનો આ સમયે બંધ રખાયા છે.

ફિઝિકલ ડિસ્ટન્સિંગ

જ્યારે રહેવાસીઓ કુટુંબ, ટ્રેઈલ્સ, પગથીઓ અથવા અન્ય સાર્વજનિક જગ્યાઓ પર બહાર નીકળે ત્યારે તેમણે અવશ્ય અન્ય લોકો (જેઓ તેમના ઘરમાં ન રહેતા હોય) વચ્ચે 2.0 મીટરનું અંતર તમામ સમયે જાળવવું. EMCPA હેઠળ પાંચથી વધુ લોકોના જમાવડા પર પણ પ્રતિબંધ છે.

પાંચ કરતા વધુ લોકો ભેગા થાય તો નાગરિકો 311 પર કૉલ કરી શકે છે.

COVID-19ને પ્રતિસાદ આપતા સમાજને સપોર્ટ કરવાના સિટીના પ્રયાસો તેમજ ઉપરોક્ત નિર્ણયો વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો www.brampton.ca/COVID19 અથવા @CityBrampton ને Twitter, Facebook અને Instagram પર ફોલો કરો. શહેરનાં બાય-લોઝ વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ટુગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca